

વિભાગીય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત યોજના “ક્ષેત્રિય પાકોમાં બીજ ઉત્પાદન” અંતર્ગત મુ. ગોરિયાદ, તા. પાદરા, જી. વડોદરા ખાતે તા. ૧૮ ફેબ્રુઆરી - ૨૦૨૦ ના રોજ ‘સંકર દિવેલામાં ગુણવત્તાસભર બીજ ઉત્પાદન’ વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત યોજના “ક્ષેત્રિય પાકોમાં બીજ ઉત્પાદન” અંતર્ગત વિભાગીય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા મુ. ગોરિયાદ, તા. પાદરા, જી. વડોદરા ખાતે તા. ૧૮ ફેબ્રુઆરી - ૨૦૨૦ ના રોજ ‘સંકર દિવેલામાં ગુણવત્તાસભર બીજ ઉત્પાદન’ વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ તાલીમમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના વિભાગીય સંશોધન કેન્દ્રના વડા, નોડલ ઓફીસર(સીડ) અને સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. આર. આર. આચાર્યની ઉપસ્થિતિમાં ૮૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર આ તાલીમમાં ભાગ લીધેલ.

નોડલ ઓફીસર અને સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. આર. આર. આચાર્યે બીજની ઉપલબ્ધિ અને ગુણવત્તા વધારવા યોજના દ્વારા થતા પ્રયાસો અંગે માહિતી આપેલ. પ્રાસંગિક ઉદબોધનમાં ડો. આર. આર. આચાર્યે ખેડૂતોને બિયારણ અંગે સતર્કતા રાખવા, ચોકસાઈપૂર્વક બિયારણની પસંદગી કરવા તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે ખેડૂતો માટે ઉપલબ્ધ જુદાજુદા વિષયોની તાલીમનો લાભ લેવા અનુરોધ કરેલ. પ્રગતિશીલ ખેડૂત શ્રી હસમુખભાઈએ ખેડૂતોને જાગૃત રહી સુક્ષ્મ પ્લાનીંગ કરવા અનુરોધ કરેલ.

ડો. એમ. પી. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી દ્વારા દિવેલા ઉત્પાદન અંગે બિયારણ, વાવણી સમય, પિયત, અગત્યના તબક્કાઓ, નર ફૂલની સંખ્યા, અને કાપણી અંગેની મુખ્ય માહિતી આપવામાં આવેલ. ડો. એ. એસ. ભાણવડીયા દ્વારા વિવિધ નવી જાતો, વાવણી અંતર, ખાતરો, નિંદામણ અને પિયત અંગે તેમજ પ્રો. વી. કે. ચૌધરી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા રોગો અને જીવાતોની ઓળખ અને તેના નિયંત્રણના વિવિધ ઉપાયો વિષે ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવેલ. ડો. એ. એસ. ભાણવડીયા અને પ્રો. વી. બી. પટેલ, દ્વારા ફિલ્ડ અંગેની બાબતોની માહિતી આપવામાં આવેલ. શ્રી જી. એસ. દોશી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આભાર વિધી કરવામાં આવેલ.



